

---

# ધ્રાન્ય પાકો



# ૧. ઘઉં - પિયત

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર, સ. ઎લ. કૃ. યુ., વિજાપુર)

## જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ કે કાંપવાળી જમીન. બે ત્રણ વખત ખેડ કરી/દાંતી રાંપ ચલાવી જમીન પોંચી, ભરભરી અને સમતળ બનાવવી.

## જાતોના નામ

### સમયસરની વાવણી

- ટુકડી જાતો: જી.ડબલ્યુ. ૩૬૬, જી.ડબલ્યુ. ૩૨૨, જી.ડબલ્યુ. ૪૬૬, જી.ડબલ્યુ. ૫૦૩, જી.ડબલ્યુ. ૧૬૦, જી.ડબલ્યુ. ૨૭૩, જી.ડબલ્યુ. ૧૧ (મર્યાદિત પિયત માટે).
- ડયુરમ (કાઢીયા) જાતો: જી.ડબલ્યુ. ૧૧૩૬, જી.ડી.ડબલ્યુ. ૧૨૫૫, એચ.આઈ. ૮૪૮૮.

### મોડી વાવણી

- જી.ડબલ્યુ. ૧૭૩, જી.ડબલ્યુ. ૧૧

### પાકનો વાવેતર સમય

- સમયસરની વાવણી: ૧૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર
- મોડી વાવણી: ૨૬ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર

### વાવેતર અંતર

- સમયસરની વાવણી: ૨૨.૫ સે.મી. બે હાર વચ્ચે પ થી ૬ સે.મી. ઊંડાઈએ
- મોડી વાવણી: ૧૮ સે.મી. બે હાર વચ્ચે પ થી ૬ સે.મી. ઊંડાઈએ

### બીજનો દર

- સમયસરની વાવણી: હેકટરે ૧૨૦ થી ૧૨૫ કિ.ગ્રા.પ્રતિ હેકટર
- મોડી વાવણી: ૧૨૫ થી ૧૫૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર

### બીજ માવજત

એઝોટોબેકટર તથા ફોસ્ફેટ કલ્યાર દરેક ૩૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે વાવતાં પહેલાં પટ આપવો.

### ખાતર

દેશી ખાતર પ્રતિ હેકટરે ૧૦ થી ૧૨ ટન જમીન તૈયાર કરતી વખતે આપવું. મગફળી-ઘઉં પાક પદ્ધતિમાં મગફળીમાં ૨.૫ ટન તથા ઘઉમાં ૨૪ ટન છાણીયું ખાતર પ્રતિ હેકટરે આપવું.

### પિયત

પાકને કુલ ૮ થી ૧૦ પિયતની જરૂરિયાત રહે છે. કોરાટે વાવણીમાં પ્રથમ પિયત વાવેતર બાદ તરત આપવું અને બીજી પિયત વાવેતર બાદ ૧૮ થી ૨૧ દિવસે અને પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસનાં અંતરે આપવા. વરાંપે વાવણીમાં વાવેતર બાદ ૧૮ થી ૨૧ દિવસે પિયત આપવું. અને પછીના દરેક પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસનાં અંતરે આપવા. શક્ય હોય તો ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો. પિયત પાણીની ઓછી સગવડ હોય તો

---

પિયતની કટોકટીની અવસ્થાઓ જેવીકે મુકૃટ મૂળ (વાવણી બાદ ૧૮ થી ૨૧ દિવસો), કુટ (વાવણી બાદ ૩૫ થી ૪૦ દિવસો), ગાલ (વાવણી બાદ ૫૦ થી ૫૫ દિવસો), ફૂલ (વાવણી બાદ ૬૫ થી ૭૦ દિવસો), ફંધીયા દાણાં (વાવણી બાદ ૭૫ થી ૮૦ દિવસો) તથા પોક (વાવણી બાદ ૮૦ થી ૮૫ દિવસો) અવસ્થાએ અવશ્ય પિયત આપવું.

### નિંદામણ

જરૂરિયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ કરવું

### પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ

- ઉધારના નિયંત્રણ માટે જમીન એકદમ સૂકાઈ ન જાય તે માટે ઢુંકા ગાળે હલકા પિયત આપવા.
- ઉધાર નિયંત્રણ માટે એરેનીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા લીલોનીનો ખોળ ૧ ટન પ્રતિ ફેક્ટર પ્રમાણે વાવણીનાં ૨ થી ૩ દિવસ પહેલા જમીનમાં આપવો.
- કચારાની આસપાસ કે ઐતરની ચારેબાજુ ગલગોટા કે ધાણાં જેવા પાકને પિંજર પાક તરીકે વાવવાથી મોલો જેવી જીવાતનું નિયંત્રણ થઈ શકે.
- ઊભા પાકમાં અડની ડાળના બેલાખડાં લગાડવાથી પક્ષીઓ આવી છયાળોનું લક્ષણ કરતાં હોવાથી વસ્તીમાં ઘટાડો કરી શકાય છે.

### પાકના મુખ્ય રોગો અને નિયંત્રણ

- સ્વભયસરની વાવણી:** થડ તથા પાનના ગેરું માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.ડબલ્યુ. ૩૬૬, જી.ડબલ્યુ. ૩૨૨, જી.ડબલ્યુ. ૪૬૬, જી.ડબલ્યુ. ૧૧, જી.ડબલ્યુ. ૨૭૩, જી.ડબલ્યુ. ૧૧૩૬, જી.ડિ.ડબલ્યુ. ૧૨૮૮નું વાવેતર કરવું.
- ઓડી વાવણી:** થડ તથા પાનના ગેરું માટે રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.ડબલ્યુ. ૧૭૩, જી.ડબલ્યુ. ૧૧નું વાવેતર કરવું.

### કાપણી અને સંગ્રહ

પિયત પાક ૮૫ થી ૧૧૫ દિવસો અને (વાવેતર કરાયેલ જાત મુજબ) કાપણી માટે તૈયાર થાય છે. પરિપક્વ અવસ્થાએ હાથથી કાપણી કરી શેશરથી દાણાં છૂટાં પાડવા અથવા કમ્બાઇન ફાર્મેસ્ટર ચલાવવું. ઘરગણ્યું ઉપયોગ માટે ૧૦૦ કિ.ગ્રા. દાણાં ૫૦૦ ગ્રામ દિવેલથી મોઇને અથવા લીમડાના ર કિ.ગ્રા. છાંયામા સૂક્ખ્યેલ પાનને મિશ્રણ કરી ગેલ્વેનાઇઝ પીપમાં સંગ્રહ કરવો.

## ૨. બિનપિયત ઘઉં

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર, સ. ઎લ. કૃ. ચુ., વિજાપુર)

ભાલ વિસ્તાર ખંભાતના અખાતની ફરતેનો વિસ્તાર છે. આ વિસ્તારની જમીન દરિયાની સપાઈથી ૧૩ ઉંચાઈની છે. આ વિસ્તારમાંથી લોગાવો, ભાડર, લીલ્કા, ઘેલો, ખારી, સાબરમતી અને મહી ખંભાતના અખાત સુધી પહોંચે તે પહેલાં ચોમાસાની ઋતુમાં તેનું પાણી આ વિસ્તારમાં ફરી વળે છે કારણકે લગભગ બધી જ નદીઓની ઊંડાઇ ૧ મીટરથી ઓછી છે. આ વિસ્તારની જમીન સપાટ અને રકાબી આકારની છે, આ જે પાણી આ વિસ્તારમાં ફરી વળે છે તે જમીન પર ચોમાસાની ઋતુમાં ભરાયેલ રહે છે. આ પરિસ્થિતિના કારણે જમીનમાં સંગ્રહેલ બેજમાં આ વિસ્તારના ખેડૂતો શિયાળું ઋતુમાં પાક લઇ શકે છે. પરંતુ આ બાબત સેન્ટ્રિય એતી માટે વિરુધ્યમાં છે કારણકે આજુબાજુના વિસ્તારમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી સોલ્ટ, રસાયણ અને પોલ્યુટેટ આપા વિસ્તારમાં ફરી વળે છે, જે સેન્ટ્રિય એતી માટે યોગ્ય નથી.

ધોલેરા, ધંધુકા અને ધોળકનો થીડો ભાગ જે ઉંચાણવાળો કે જેને બિનપિયત કપાસ, ધાસચારાની જુવાર, ઘઉં અને ચણા સેન્ટ્રિય એતી માટે પંસદ કરી શકાય.

સુધારેલી જાત	: એ-૨૦૬, એ-૨૧૪, એ-૨૮ અને ગુજરાત ઘઉં-૧
બિયારણનો દર	: ૬૦ કિ.ગ્રા./પ્રતિ હે.
બિયારણને માવજત	: એ.ઓ.સ્પે.રી.લમ કલ્યાર અને પી.ઓ.સલ્વી
વાવણી અંતર	: ૩૦ સે.મી.
વાવણી સમય	: ઓક્ટોબરના છેલ્લાં અઠવાડીયા થી નવેમ્બરના પ્રથમ અઠવાડીયા
સેન્ટ્રિય ખાતર	: ૧૦ ટન/હેક્ટર.
મર્યાદિત પિયત	: વાવણી બાદ ૨૧ દિવસ

## ૩. બાજરા

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય બાજરા સંશોધન કેન્દ્ર, જી. કૃ. યુ., જામનગર)

### જમીન અને જમીનની તૈયારી

હળની એક તથા કળીયાની બે થી ત્રણ પેડ કરી ૪૫ સે.મી. અથવા ૬૦ સે.મી. ના અંતરે ચાસ ઉધાડવા. આગલાં પાકના અવશેષો શ્રેદર દ્વારા અથવા રોટાવેટરથી જમીનમાં લેળવવાં.

### વાવેતરનો સમય

**ચોમાસુ:** વાવણી લાયક વરસાદ થયે તરત જ વાવેતર કરવું. જેથી વધુ ઉત્પાદન મળે, રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે અને પછીનો પાક દેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય. જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઈ પછી થાય તો વહેલી પાકતી જાતનું વાવેતર કરવું.

**ઉનાળું:** બાજરીનું વાવેતર ઠંડી ઓછી થયે કેબ્લ્યુઆરી થી ૧૫ માર્ચ સુધી જ કરવું હિતાવહ છે. મોડુલ વાવેતર કરવાથી દાણાં બેસવાના સમયે ગરમીના કારણે ઉત્પાદન ઘટે છે તેમજ પાકવાના સમયે વરસાદ થાય તો દાણાંની ગુણવત્તા બગડે છે.

**પૂર્વ-રવી:** બાજરીનું વાવેતર ૧૫ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર સુધીમાં કરી દેવું હિતાવહ છે. મોડુલ વાવેતર કરવાથી દાણાં બેસવાના સમયે ઠંડીને કારણે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

### બીજનો દર અને વાવેતર અંતર

**ચોમાસુ:** હેકટરે બિયારણનો દર ૪ કિ.ગ્રા. (ક્ષારીય, ક્ષારીય-ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./ હેકટર) પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪૫ અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સે.મી.થી વધારે ઊંડે ન જાય તે રીતે વાવેતર કરવું.

**ઉનાળું અને પૂર્વ-રવી:** હેકટરે બિયારણનો દર ૪ કિ.ગ્રા. (ક્ષારીય, ક્ષારીય-ભાસ્મીક અને ભાસ્મીક જમીન માટે ૬ કિ.ગ્રા./ હેકટર) પ્રમાણે રાખી દંતાળથી બે હાર વચ્ચે ૪૫ અથવા ૬૦ સે.મી. અંતર રહે અને બીજ જમીનમાં ૪ સે.મી.થી વધારે ઊંડે ન જાય તે રીતે વાવેતર કરવું. ઉનાળામાં વાવેતર દંતાળથી તેમજ ચોપીને પણ કરી શકાય છે. ઉનાળું હાઇબ્રિડ બાજરીનું ફેરરોપણી પદ્ધતિથી વાવેતર કરવાથી ઉત્પાદન વધુ મળી શકે છે. માર્ચ મહિનાના પ્રથમ પખવાડીયામાં ઉછેર કરેલ ૨૦ થી ૩૦ દિવસના ધરુની ફેરરોપણી કરવી.

### બીજ માવજત

બીજને એટેટોબેકટર, એઝોસ્પ્રીલમ અને ફોસ્ફેટ કલ્યરનો પણ આપવો.

### જાતો અને તેની પસંદગી

હાઇબ્રિડ બાજરીમાં કુતુલ સામે પ્રતિકાર કરી શકે તેલી નીચે જણાવેલ નવી જાતો વાવેતર માટે ભલામણ કરેલ છે.

- **ચોમાસુ:** : જુએચબી-૫૫૮, ૭૩૨ (મોડી પાકતી)  
                          જુએચબી-૭૪૪, ૬૦૫ (મધ્યમ પાકતી)  
                          જુએચબી-૫૩૮, ૭૧૬ (વહેલી પાકતી)
- **ઉનાળું** : જુએચબી-૫૫૮, અને ૫૩૮
- **પૂર્વ-રવી** : જુએચબી-૫૩૮

## પારવણી અને ખાતાં પૂરવાં

પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારે બે છોડ વચ્ચેનું અંતર ૧૦ થી ૧૨ સે.મી.નું રહે તે પ્રમાણે વધારાના નબળાં, રોગ અને જીવાત લાગેલ છોડને ખેંચી કાઢવા. જે હારોમાં મોટા ગામા-આલાં હોય ત્યાં ભેજની યોગ્ય પરિસ્થિતિમાં પારવણીની સાથોસાથ નિકળેલાં તંદુરસ્ત છોડની ફેરારોપણી કરી છોડની પૂરતી સંખ્યા જાળવવી.

### ખાતર

હેકટરે ૧૦ ટન દેશી ખાતર પ્રાથમિક એડ પહેલાં નાખી અને એડથી જમીનમાં ભેગવવું અથવા ચાસે ભરવું. જૈવિક ખાતરો જેવાકે એજેટેબેકટર, એઝોલ્યુરીલમ અને ફોસ્ફેટ કલ્યરનો ઉપયોગ કરવો.

### નિંદામણ અને આંતરએડ

પાકમાં નીંદણના નિયંત્રણ માટે અને જમીનની લૌટિક પરિસ્થિતિ સારી રહે તે માટે વાવણી બાદ ૨૦ અને ૪૦ દિવસે આંતરએડ અને હાથ નિંદામણ કરવું.

### પિયત

- શોમાસુ** : ચોમાસુ બાજરીમાં સામાન્ય રીતે પિયતની ભલામણ કરવામાં આવતી નથી કારણેકે બાજરી મુખ્યત્વે વરસાદ આધારીત પાક છે. વરસાદની ખેંચ જણાય તો પૂરક પિયત આપવાની લલામણ છે.
- ઉનાળુ** : ઉનાળુ બાજરીમાં કુલ ૮ થી ૧૦ પિયત, દરેક પિયત ૮ થી ૧૦ દિવસનાં અંતરે આપવા.
- પૂર્વ-રવી** : પૂર્વ-રવી બાજરીમાં કુલ ૬ થી ૮ પિયત, દરેક પિયત ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે આપવા.

### જીવાત નિયંત્રણ

#### સાંઠાની માખી

- પહેલાં વરસાદ પછી તાત્કાલિક વાવેતર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
- બિયારણનો દર હેકટરે ૫ કિ.ગ્રા. રાખવો.
- પારવણી વખતે જીવાતથી નુકશાન પામેલ છોડ દૂર કરી તેનો નાશ કરવો.
- બાજરાની બે હાર વચ્ચે એક હાર મગ અથવા તુવેરને આંતરપાક તરીકે લેવાથી સાંઠાની માખી અને લીલી ઈયળનો ઉપદ્રવ ઘટે છે.

#### ગાભમારાની ઈયળ

- આગલાં પાકના જડીયા વીણી દૂર કરવા.
- નુકશાન પામેલ છોડની લુંગળી ઈયળ સાથે ખેંચી તેનો નાશ કરવો.
- બિયારણનો દર હેકટરે ૫ કિ.ગ્રા. રાખવો.

#### કુંડાની ઈયળ

- પાક કુંડા અવસ્થાએ આવે ત્યારે એકરે એક પ્રકાશ પીંજર ગોઠવી, આકર્ષાયેલાં કુંદાનો નાશ કરવો.
- કુંડામાં લીલી ઈયળનું નુકશાન હોય તો ફેરોમેન ટ્રેપ હેકટરે પાંચની સંખ્યામાં ગોઠવવાં.

#### કાસીથા

- છોડ પરથી કાંસીથા અંદરી કેરોસીનવાળા પાણીમાં એકટાં કરી તેનો નાશ કરવો.
- પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો.

#### પક્ષીશી રક્ષણ

- પક્ષીશી ક્ષારા થતું નુકશાન અટકાવવા દુધીયા દાણાં અવસ્થાએ ચમકતી પદ્દીઓ (રીબીન) ગોઠવવી.

---

## રોગ નિયંત્રણ

જો બિયારણમાં અરગટની પેશીઓ રહેલી હોય તો બીજને ૨૦% મીઠાનાં દ્રાવણમાં બોળી, ચોખા પાણીથી ધોઈ, સુકવ્યા બાદ વાવેતર કરવું. ચોમાસુ શરૂ થયા બાદ અથવા તો તેના પ્રથમ અઠવાડિયા સુધી, પૂરતો લેજ હોય ત્યારે બાજરીનું વાવેતર કરવાથી ફુતુલ, અરગટ અને ગેરું જેવા રોગોનું પ્રમાણ ઘટે છે અને સરખામણીમાં દાણાં અને સુકાંચારાનું ઉત્પાદન વધે છે. ૧૫ જુલાઈ બાદ વાવેતર કરવાથી આ રોગોની તિવાતા વધારે જોવા મળે છે આથી ઉત્પાદનમાં પણ ઘટ આવે છે.

### કાપણી

પાક તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી. કુંડા બરાબર તપાવી, દાણાં છૂટાં પાડી, દાણાંને બરાબર સાફ કરી, પૂરતાં સૂકવી, વધારાનો લેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે ચોગ્ય જગ્યાએ રાખવા.

## ૪. જુવાર

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ., સુરત)

### જમીનની તૈયારી

જમીનની તૈયારી માટે એક વખત દેશી હળ અથવા ડ્રેક્ટરથી ફરી શકે તેવા ફાળવાળા હળથી અને બે વાર કરબથી ૧૦-૧૫ સે.મી. ઉંડી ખેડ કરવી. હેક્ટર દીઠ ૧૦ થી ૧૫ ગાડા છાણીયું ખાતર/ કમ્પોસ્ટ ખેડ કરતોં પહેલાં જમીનમાં ભેણવી દેવું. વાવણી મોડી થાય તેમ હોય તો ખેતરને નીંદણથી મુક્ત રાખવું. ખેતર સમતોલ બનાવવું, વધારાના પાણીના નિતાર માટે ખેતરની ફરતે ઉંડી કાંસ બનાવવી.

### બીજની માવજત

બીજને માવજત આપ્યા વગર વાવવાથી બીજને ફૂગ લાગવાથી છોડની સંખ્યા ઓછી મળે છે. તેથી બીજને વાવતાં પહેલાં ટ્રાયકોડમાં ફૂગનાશકની બીજ માવજત આપવી. ફૂગનાશક દાણાને બરાબર ચોટે તે માટે દિવેલનો સ્ટીકર તરીકે ઉપયોગ કરવો.

### જાતો

દાણાં માટે	દીલા ચારા માટે
સ્થાયી જાતો જીજે-૩૬, ૩૮, ૪૨, બીપી-૫૩, નિઅર ગોટી, સુરત-૧ અને જીજે-૧૦૮	સીએસવી-૨૧એફ, જીએફએસ-૪, ૫ માલવણ, ગુંડરી, છાંસીઠીયો.
સેકર જાતો સીએસએચ-૧૬, ૧૮, ૨૫	
વાવણીનો સમય	

સંકર અને વધુ ઉપજ આપતી સ્થાયી જાતો માટે યોમાસુ બેસતાં અને સ્થાનિક જાતો માટે મોડા યોમાસુ તરીકે એટલેકે ઓગાઝમાં વાવણી કરવી.

### બિયારણનો દર, અંતર અને છોડની સંખ્યા

- ૧) બિયારણનો દર : ૧૦ થી ૧૨ કિ.ગ્રા./હેક્ટર
- ૨) વાવેતર અંતર : ૪૫ સે.મી. × ૧૫ સે.મી.
- ૩) છોડની સંખ્યા : ૧.૮૦ થી ૨.૦૦ લાખ/હેક્ટર

### ધામા પૂરવા, ફેરસોપણી તેમજ પારવણી

વધુ ઉત્પાદન મેળવવા માટે પાક ૨૦ દિવસનો થાય ત્યારે ધામા (ખાલાં) ફેરસોપણી થી પૂરવાં તથા છોડની સંખ્યા એકથી વધારે હોય ત્યાં એકજ છોડ રાખી બાકીના છોડ ઉપાડી લેવાં તેમજ જયાં ખાલાં હોય ત્યાં ફેરસોપણી કરવી.

### ખાતર

૧૦ થી ૧૫ ગાડા છાણીયું ખાતર પ્રતિ હેક્ટર જમીન તૈયાર કરતી વખતે આપવું. જૈવિક ખાતર જેવાકે એટેટોબેક્ટર, પી.એસ.બી., કે.એમ.બી. ૨.૫ લીટર પ્રતિ હેક્ટર છાણીયા ખાતર સાથે મિશ્ર કરીને આપવું.

### નીંદણ નિયંત્રણ અને આંતરખેડ

જુવારના પાકમાં નીંદણ નિયંત્રણ માટે એક આંતરખેડ અને વાવ્યા પછી ૩૦-૩૫ દિવસે હાથથી એક નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આગિયાનો ઉપદ્રવ અટકાવવા માટે પાકની ફેરબદલી કરવી.

## પિયત

જો યોમાસામાં પાછલો વરસાદ સારો હોય તો જુવારના પાકને પાણીની જરૂર રહેતી નથી. આમ છતાં કેજની જે ચ વર્તાય તો પાકની કટોકટીની અવસ્થાઓ જેવીકે ફૂલ અવસ્થા તેમજ દાણાં ભરાવાની અવસ્થાએ પિયતની સગવડ હોય તો પિયત અવશ્ય આપવું.

## જુવારમાં આંતરપાક

જુવારમાં આંતરપાક તરીકે તુવેરનો પાક ખૂબજ અનુકૂળ જણાયો છે. દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જુવારની બે હાર અને તુવેરની એક હાર રાખી ૪૫ સે.મી.ના અંતરે વાવેતર કરવાની ભલામણ છે. જુવારના એકલાં પાક કરતાં આંતરપાકમાં તુવેરનું વધારાનું ઉત્પાદન મળે છે. તુવેરની બીડીએન ર અથવા વૈશાલી જાત આંતરપાક તરીકે અનુકૂળ જણાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો સ્થાનિક જાતો કે જે મોડા વાવેતર માટે અનુકૂળ છે, તેવી બીપી ૫૩, સુરત ૧ અને જુજે ૧૦૮ નિઝર ગોટી અપનાવે છે. આ જાતોની ઉત્પાદકતા ખૂબ ઓછી તેમજ દાણાં ફૂગગ્રાસ છે. ગુજરાત જુવાર ૩૮ અને જુજે ૪૨ ની દાણાંની ગુણવત્તા દેશી જાતો જેવી છે. ખેડૂતોએ ગુજરાત જુવાર ૩૮ અને જુજે ૪૨ તેને અનુરૂપ વિકસાવેલ આપુનિક જેતી પદ્ધતિઓ વધુ ઉત્પાદન મેળવવા માટે અપનાવવી જોઈએ.

ધાસચારાના પાકોમાં જુવાર પાક વધુ પ્રચલિત છે. કારણકે તેમાં અન્ય પાકોની સરખામણીમાં પોષકતત્વો વધુ હોવાથી પશુઓ લીલા ધાસચારા, સૂકાચારા કે અથાણા (સાઈલેજ) તરીકે તેને વધુ પસંદ કરે છે. આ પાક પાણીની અછિત સામે ટક્કર જીલી શકે છે. તેમજ વધુ વરસાદ સામે પણ ટકી શકે છે. વધુમાં ક્ષારવાળી જમીનમાં પણ થઈ શકે છે.

જુવાર પાકને ફક્ત ધાસચારા (બાડુ) તરીકે ઉગાડવામાં આવે તો તેમાં દાણાં લીધા બાદ રાખેલ ધાસ (કડબ) માં વધુ પોષક તત્વો રહેલા હોય છે. લીલોચારો પશુને ખવડાવવામાં આવે તો તેમાંથી કેરોટીન અને પ્રજીવકો જેવા તત્વો પણ વધારાના મળી શકે છે. જુવારનો ધાસચારો ઉંચી ગુણવત્તા ધરાવે છે. જેથી પાક સુધારણા કામગીરી સઘન બનાવતાં હાલમાં સુધારેલી જાતો જુએક્સેસ ૩, જુએક્સેસ ૪, જુએક્સેસ ૫ અને સીએસવી ૨૧એક વિકસાવીને વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.

જુવાર પાકને ફક્ત ધાસચારા (બાડુ) તરીકે ઉગાડવાળા વિસ્તારમાં લીલા તેમજ સુકાચારા તરીકે અનુકૂળ આવે તેવી જાત જુએક્સેસ ૫ નું વાવેતર કરવું. આ જાત ઉંચી, મધ્યમ જાડા થડવાળી, પહોળા પાન અને મીઠી તથા રસદાર સાંઠો ધરાવે છે. ધાસચારાની આ જાત પાનના ટપકાના રોગ તથા ગાલ્ભમારાની ઈયળ સામે પ્રતિકારક છે. આ જાતમાં ૬૫-૭૦ દિવસે ફૂલ આવે છે અને એક કરતાં વધુ વાઢ માટે વરસાદ આધારિત વિસ્તારમાં અનુકૂળ છે.

## પાક સંરક્ષણ

### જુવાત વ્યવસ્થાપન

#### ૧. સાંઠાની માખી:

- પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
- જુવારની વહેલી વાવણી કરવાથી આ જુવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે.
- જુવારની સીધી ઓરીને વાવણીમાં બીજદર વધુ (૧૨.૫ કિ.ગ્રા./હેક્ટર) રાખી નુકશાનવાળા છોડની પારવણી કરી છોડની સંખ્યા જાળવી શકાય છે.
- ૫% લીમડાના બીજનું દ્રાવણ (૫૦૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં) જુવારની વાવણી બાદ ૨૫ દિવસે છંટકાવ કરવાથી સાંઠાની માખીનું નિયંત્રણ થાય છે
- પાકની કાપણી બાદ તરત જ ખેડ કરી જુના પાકના અવશેષોનો નાશ કરવો.

## ૨. સાંઠાનો વેધક અને સાંઠાનો જુવાણી વેધક:

- પાકના અવશેષો અને જડિયાંનો નાશ કરવો. જેથી જુવાતની છુપી અવસ્થાનો નાશ થાય છે.
- અંતરપાક તરીકે ચોળી કે વાલ પાપડીના પાકની જુવારની દર ચાર હાર બાદ એક હારની વાવણી કરવી.
- જુવાતની મોજણી માટે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
- ૫% લીમડાના બીજનું દ્રાવણ જુવારની વાવણી બાદ ૨૫ દિવસે છંટકાવ કરવાથી સાંઠાના વેધકનું નિયંત્રણ થાય છે.
- “ડેડ હાર્ટ” સહેલાઈથી મેંચી શકાય તેવો હોવાથી તેને મેંચી કાઢી ચારા તરીકે કે સેન્ક્રિય ખાતર બનાવવામાં ઉપયોગ થઇ શકે છે.

## ૩. કણસલાની જુવાતો:

- ઉનાળામાં ઊડી એડ કરવી.
- ઘેતરના શેઢા-પાળા ચોખમાં રાખવા.
- પાકની કણસલાં અવસ્થાએ રાત્રીના સમયે ર થી ર પ્રકાશ પિંજર/હેક્ટર ગોડવવા.
- લીલી ઈયળની મોજણી માટેના ફેરોમેન ટ્રેપ ૫/હેક્ટર લગાડવા.
- ઘેતરમાં પક્ષીઓને બેસવા માટે લાકડાના ટેકા ૫૦/હેક્ટર લગાડવા.
- જુવારના કણસલાની ઈયળના નિયંત્રણ માટે એચ.એન.પી.વી. ૨૫૦ એલ.ઇ./હેક્ટર પાકમાં કણસલા નિકળવાની અવસ્થાએ છંટકાવ કરવો.
- ઉપક્રમિત પીલાને તથા સૂકાઈ ગયેલાં કણસલાંના છોડને બાળી નાખવા અથવા ઊડા ખાડામાં દાટી દેવા.
- જુવારના ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે દ્રાયકોગ્રામા ભમરી બે લાખ પ્રતિ હેક્ટર જુવારના પાક ઉગ્યા બાદ ૨૧ દિવસે છોડવી.
- ઉનાળામાં જ્યાં ચારા માટે જુવાર ઉગાડવામાં આવે ત્યાં કણસલાં કાપીને ફોરને ખવડાવી દેવા.
- એક જ વાવેતર વિસ્તારમાં એક સાથે એક જ જાતની વાવણી કરવી જોઈએ અને વહેલી વાવણી કરવાથી પણ આ જુવાતોનો ઉપક્રમ ઘટાડી શકાય છે.
- શિયાળુ પાક માટે સપેન્નરના પહેલાં પખવાડીયામાં વાવણી કરવી.
- જુવારના પાકમાં કણસલાં ચૂસિયા, મોલો-મશી તથા પાન કથીરીના નિયંત્રણ માટે લીબોળીના બીજનું ૫% મિશ્રણ (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) છાંટવાની ભલામણ છે.

## રોગનું સંકલિત નિયંત્રણ

- પાછલા પાકના અવશેષોનું જડિયાં સાથે નાશ કરવો. ઉનાળામાં ઊડી એડ કરવી.
- અવારનવાર પાકની ફેરબદલી કરતાં રહેવું
- રોગમુક્ત બિયારણની પસંદગી કરવી
- સમયસર વાવણી કરવી.
- મધીયાના જાલાસ્મો બીજમાંથી દૂર કરવા. બીજને ૨૦% મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતાં જાલાસ્મો દૂર કરી ચોખમાં પાણીએ ઘોઈ સૂકવીને વાવવાના ઉપયોગમાં લેવા
- રોગિષ છોડને ઉપાડીને નાશ કરવો
- દાણાંની કૂગાના નિયંત્રણ માટે રોગ આવતાં પહેલાં વહેલી પાકી જતી હોય તેવી જાત પસંદ કરવી.

## કાપણી

તમામ સુધારેલ/સંકર જાતો ૨૦-૨૪% દાણાંનો લેજ હોય ત્યારે જ કાપણી કરવી ચોગ્ય છે. આ સમયે કાપણી કરવાથી ૧૦-૧૫% વધુ ઉત્પાદન મળે છે અને બીજો પાક લેવા માટે ૮ થી ૧૦ દિવસનો વધુ ગાળો મળે છે.

## ૫. મકાઈ

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ. કૃ. યુ., ગોધરા)

મકાઈ ગુજરાત રાજ્યનો અગત્યનો ધાન્ય પાક છે. ગુજરાત રાજ્યમાં આશરે ૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થાય છે જેમાંથી આશરે ૭ લાખ મેટ્રિક ટન ઉત્પાદન મળે છે. રાજ્યમાં મકાઈનું વાવેતર કરતાં જીલ્લાઓમાં પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા, છોટાઉંદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને નર્મદા મુખ્ય છે. આ પાકનું સૌથી વધુ વાવેતર (૨. ૭૦ લાખ હેક્ટર) મધ્ય ગુજરાતમાં થાય છે.

### આબોહવા

વિવિધ પ્રકારની આબોહવામાં મકાઈનો પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. અર્ધસૂકા વિસ્તારથી મધ્યમ વરસાદવાળા વિસ્તારમાં આ પાકનું વાવેતર કરી શકાય છે.

### જમીન અને જમીનની તૈયારી

સામાન્ય રીતે સારાં નિતારવાળી, ફળદૂપ, સમતળ ગોરાડું, બેસર અને મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ચોમાસા પહેલાં ૬ ઈંચ ઊંડાઈની ટ્રેક્ટર દેશીહળની આડી ઉલ્લી એડ કરવી જેથી વરસાદનું પાણી જમીનમાં પૂરતાં પ્રમાણમાં પણે. આગલાં પાકના જડિયાં કચરો વિષી મેતર સાફ કરવું. જેથી ઉધેઈ જેવી જીવાતનો ઉપદ્રવ થતો રોકી શકાય. વરસાદ પડયાં પછી વરાપ આવ્યા બાદ ટ્રેક્ટર અથવા હળની આડી ઉલ્લી બે એડ કરી સમાર મારી જમીન તૈયાર કરવી. એડ કરતાં પહેલાં ૨૫ ગાડી/હે. સેન્ટ્રિય ખાતર જમીનમાં ભેગવવું.

### વાવેતર સમય

ચોમાસુ મકાઈનું ૧૫ જૂન થી ૧૫ જુલાઈ સુધી વાવેતર કરી શકાય. શિયાળુ મકાઈનું ૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધી વાવેતર કરવું.

### ચોમાસુ:

- દેશી/સંયોજ્ઞત જાતો: ગુજરાત મકાઈ-૨ (પીળી), ગુજરાત મકાઈ-૪ (સફેદ), ગુજરાત મકાઈ-૬ (સફેદ), નર્મદા મોતી (સફેદ).
- સીગલ કોસ હાઇબ્રિડ: એચ.ક્ર્યુ.પી.એમ.-૧ (કવોલીટી પ્રોટીન), જી.એ.વાય.એમ.એચ.-૧ (પીળી), જી.એ.ડબલ્યુ.એમ.એચ.-૨ (સફેદ), ગંગા સફેદ-૨.

### શિયાળુ:

- સંયોજ્ઞત જાતો: ગુજરાત મકાઈ-૩, માધુરી (સ્ટીટ કોર્ન-લીલા ડોડા માટે), અંબર (પોપ કોર્ન-ધાણી માટે)
- સંકર જાતો: એચ.ક્ર્યુ.પી.એમ.-૧ (કવોલીટી પ્રોટીન), સી.ઓ.-૬, ગંગા સફેદ-૨. એચ.ક્ર્યુ.પી.એમ.-૧માં લાયસીન અને ટ્રીપોફેન નામના કવોલીટી પ્રોટીનની માત્રા સામાન્ય મકાઈ કરતાં બમણી હોય છે.

### મકાઈની સંયોજુત/સંકર જાતો

અ. નં.	સુધારેલી જાતો	ઉત્પાદન (કિ.ગ્રा./હે.)	વાવેતર માટે ભલામણ કરેલ વિસ્તાર	પાકવાના દિવસો	દાખાનો રેગ
<b>સંયોજુત જાતો</b>					
૧	ગુજરાત મકાઈ-૨	૨૮૩૦	ઉત્તર ગુજરાત ઓન	વહેલી પાકતી ૮૫-૮૦	પીળો થોડો ચળકતો દાણો
૨	ગુજરાત મકાઈ-૪	૩૦૦૦	મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓન	૮૦-૮૫	સફેદ ચળકતો દાણો
૩	ગુજરાત મકાઈ-૬	૩૦૦૦	મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓન	૭૫-૮૦	સફેદ ચળકતો દાણો
૪	નર્મદા મોતી	૪૦૦૦	મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓન	૮૦-૮૫	સફેદ ચળકતો દાણો
૫	બિન ઓરેન્જ સ્લીટ કોર્ન (મોઠી મકાઈ)	૧૩-૧૪ ટન લીલા ડોડા	સમગ્ર ગુજરાતં	૫૫-૬૫	આછો પીળાશ પડતો
૬	અંબર (ધાણી માટે)	૨૫૦૦	સમગ્ર ગુજરાત	૮૦-૮૫	પીળો દાણો
૭	આફિકન ટોલ	૧૫-૩૦ ટન લીલો ચારો	સમગ્ર ગુજરાત	૬૦-૬૫	સફેદ
૮	પી.એ.ચ.એમ.-૪	૧૫૦૦ કિ.ગ્રा./હે.	સમગ્ર ગુજરાત	૫૦-૫૫	સફેદ/પીળો
<b>સંકર જાતો :</b>					
૯	ગંગા સફેદ-૨	૨૮૮૮	મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓન	૧૦૦-૧૧૦ દિવસ	સફેદ થોડા ચળકતો
૧૦	એચેપીક્યુએમ	૬૫૦૦	મધ્ય તથા દક્ષિણ ગુજરાત	૮૫-૧૦૦	પીળો
૧૧	જુએડબલ્યુએમચેચ-૨	૪૦૦૦	મધ્ય ગુજરાત	૮૦-૮૫	સફેદ
૧૨	જુએવાયએમચેચ-૧	૪૧૦૦	મધ્ય ગુજરાત	૮૦-૮૫	પીળો ચળકતો

### બિયારણનો દર અને બીજ માવજત

ઇડની સંપ્રાય પ્રમાણમાં (હેકટરે ૮૦,૦૦૦ થી ૮૫,૦૦૦ ઇંડ) જગવાય રહે તે માટે હેકટરે ૨૦-૨૫ કિ.ગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. બીજને વાવતાં પહેલાં ૧ કિ.ગ્રા. બીજ દીઠ એઝેટોબેકટર અને એઝોસ્પ્રેચીલમ કલ્યરનો ૫૦ ગ્રામ લેખે પટ આપી છાંધક સૂકવી ઉપયોગમાં લેવું.

### વાવણી અંતર

- (૧) સંયોજુત જાતો : ૬૦ સે.મી. × ૨૦ સે.મી.
- (૨) સંકર જાતો : ૬૦-૭૫ સે.મી. × ૨૦ સે.મી.

### સેન્ટ્રિય ખાતર

જીમીનની બેજ સંગ્રહશક્તિ વધારવા માટે પૂરતી માત્રામાં સેન્ટ્રિય તત્વ જરૂરી છે, તે માટે હેકટરે ૧૦ થી ૧૨ ટન છાણીયું ખાતર તથા ૧ ટન દિવેલાનો ખોળ વાવણી પહેલાં ૧૫ દિવસ અગાઉ આપવો. ત્યારબાદ ખેડ કરી વાવેતર કરવું.

## પારવણી

પાક ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારે રોગ-જીવાત મુક્ત તંકુરસ્ત છોડ ૨૦ સે.મી.ના અંતરે રહે તેમ પારવણી કરવી જોઈએ.

### અંતરખેડ અને નીદામણી

વાવણી પછી ૨૦ અને ૩૦ દિવસે અંતરખેડ તથા હાથ નિંદામણ કરી નીદાશ ફૂર કરવું જોઈએ.

### પાળા ચઢાવવા

વાવેતર બાદ એક માસ પછી પાક ઢીંચણ જેટલી ઉંચાઈનો થાય ત્યારે યોગ્ય માપની કરબడીના દાઢાને દોરી વિંટાળી અથવા રીજર વડે પાળા ચઢાવવા જોઈએ.

### પિયત

સામાન્ય રીતે વરસાદ અનુકૂળ હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી. પરંતુ વરસાદની ખેચ વર્તીય અને પાક સૂક્ષ્વા લાગે ત્યારે જરૂરિયાત મુજબ પિયત આપવાથી પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શાય છે. બિયારણના સ્કુરણ અને ઉગવાના સમયગાળા દરમયાન, કૂલ આવવાના સમયે અને ફૂધિયા દાણાંની અવસ્થા દરમયાનના સમયગાળામાં પૂરતાં પ્રમાણમાં લેજ હોવો જોઈએ.

### પાક સરકાર

મકાઈના પાકમાં મુખ્યત્વે ગાભમારાની ઈયળનો ઉપક્રમ વધુ જોવા મળે છે. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે મકાઈમાં ૧૦ હાર બાદ ર હાર ચોળીનું વાવેતર કરવાથી નિયંત્રણ કરી શકાય છે.

રોગોમાં ખાસ કરીને પાછોતરા સૂકારા માટે હેકટરે ૧ ટન લીબોળનો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવો અસરકારક છે. લીમડાના પાનનો રસ ૧૦% મુજબ છાંટવો, સાથે સાથે ટાઇકોડર્મા ૭ ગ્રામ/ક્રિ.ગ્રા. બીજ માવજત આપવાથી મકાઈના રોગનું નિયંત્રણ કરી શકાય છે. પાનનો સૂકારો (મેઠીસ લીફ બ્લાઇટ)ના નિયંત્રણ માટે વાવણી માટે રોગમુક્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું. મધ્યમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જીવીક ગંગા સફેદ-૩, ગુજરાત મકાઈ-૨, ગુજરાત મકાઈ-૪, ગુજરાત મકાઈ-૬, નર્મદા મોતી, એચ.કયુ.પી.એમ.-૧, એચ.એમ.-૫ વાવવા માટે ઉપયોગમાં લેવી. સુનિયોજીત પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને જમીનમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રામવી.

### અંતરપાક પદ્ધતિ

આપણાં રાજ્યમાં ચોમાસુ અનિયમિત હોય તેવા સંજોગોમાં વરસાદ આધારિત મકાઈનો પાક ઓછો થવાની અથવા નિષ્કળ જવાની શક્યતાઓ રહેલી હોય છે. જીથી ચોમાસુ મકાઈના વરસાદ આધારિત પાકમાં અંતરપાક કરવા હિતાવહ છે. પંચમહાલ, શિલ્વામાં મકાઈ ઉગાડતાં એઝ્ટોઓ તુવેર બી.ડી.એન-૨, ૧:૧ ના પ્રમાણથી ૪૫ સે.મી.ના અંતરે વાવેતર કરવું. આ સિવાય મકાઈ + દિવેલા ૨:૨ અને મકાઈ + મગફળી ૨:૨ પ્રમાણમાં લેવાથી પણ સારો નફો મળે છે. મગફળી + સ્વીટ કોર્ન/પોપ કોર્ન ૨:૧ના પ્રમાણમાં લઇ શકાય.

### કાપણી અને ઉત્પાદન

ચોમાસામાં સંયોજીત જાતો ૮૦-૬૦ દિવસે, જ્યારે સંકર જાતો ૧૦૦-૧૨૦ દિવસમાં કાપણી માટે તૈયાર થાય છે. શિયાળામાં સંયોજીત જાતો ૧૧૦-૧૧૫ દિવસે, જ્યારે સંકર જાતો ૧૨૦-૧૩૫ દિવસમાં કાપણી માટે તૈયાર થાય છે. દાણાંમાં ૧૫ થી ૨૦% લેજ હોય, ડોડાનું કવચ સૂક્ષ્મ બદામી રેગનું થાય અથવા દાણાંની નીચેના ભાગમાં કાળી ટપકી પડી જાય ત્યારે પાકની કાપણી કરવી. ડોડા તોડયાં પછી તાપમાં સૂક્ષ્મ્ય બાદ થ્રેસરથી કે શેલરથી દાણાં છૂટા પાડી સ્થૂર્યપ્રકાશમાં તપાવવા જોઈએ.

આમ લલામણ પ્રમાણે સુધારેલ જાતો અને સંકર જાતોનો ઉપયોગ કરવામાં આવે તો ચોમાસામાં હેકટરે અનુક્રમે ૩૦-૪૦ અને ૪૫-૫૦ કિવન્ટલ, જ્યારે શિયાળામાં અનુક્રમે ૫૦-૬૦ અને ૬૦-૧૦૦ કિવન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે.

## ૬. નાગલી

(સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃષિ સંશોધન કેન્દ્ર (મીલેટ), ન. કૃ. યુ., વધઈ)

ગુજરાતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમા નાગલી, મોખરાનુ સ્થાન ધરાવે છે. નાગલી એ કુંગરાઉ પ્રદેશમાં વસતાં આદિવાસીઓનો મુખ્ય ઘોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમા નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં કુલ ૧૪,૧૬૧ હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થાય છે. તેમાંથી ૧૮,૬૦૫ મે.ટન ઉત્પાદન મળે છે. ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ, વલસાડ તાપી અને પંચમહાલ જીલ્લામાં થાય છે. નાગલીને અંગેજુમાં ફીંગર મિલેટ અથવા આફિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.

નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે. તેના દાણાંમાં પ્રોટીન, ઝનીજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેખાની માત્રા વધારે હોવાથી ડાયબીટીસ અને હદદ રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્બ્યાયમ અને લોહનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં સંવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી કૂડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતાં આદિવાસી ઘેરૂનો નાગલીના લોટમાથી રોટલાં બનાવી ખાય છે. આ ઉપરાંત તેના લોટમાથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ, નાનમટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધક વાનગીઓ બનાવી શકાય છે.

### જમીનની પસંદગી

નાગલી વિવિધ પ્રકારની જમીન, આબોહવા તથા જ્યાં અન્ય પાક ઉગાડવાની શક્યતા ઓછી હોય તેવી ઓછી ફળદૂપ અને ઢાળવાળી જમીનમાં લઈ શકાય છે. પરંતુ સારાં નિતારવાળી લાલ, રાખોડી, ગોરાડું અને હલકી અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.

### બીજની માવજત

બીજ જન્ય રોગ અટકાવવા માટે સ્યુડોમોનાસ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ પ્રમાણે તેમજ રાસાયણિક ખાતરના કાર્યક્રમ ઉપયોગ માટે બીજને એઝેટોબેક્ટર/એઝોસ્પિરીલમ તેમજ પીઓસબી જેવા જૈવિક ખાતરનો પટ આપવો.

### બિયારણનો દર

લાલમણે કરેલ જાતોનું પ્રમાણિત, શુદ્ધ, ગુણવત્તા સભર બિયારણની પસંદગી કરી એક હેક્ટર દીઠ ૪ થી ૫ કિ.ગ્રા. બિયારણ વાપરવું.

### જાતો:

#### (૧) ગુજરાત નાગલી - ૪ (લાલ)

આ જાત લાલ દાણાંવાળી, ૧૨૫-૧૩૦ દિવસમા એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. આ જાતના ફુડા લાંબા અને અર્ધ ઘણ તથા ફુડામા દાણાંની સંખ્યા વધારે હોય છે. એકરે સરેરાશ ૧૨૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમોડી જેવા રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે.

#### (૨) ગુજરાત નાગલી - ૫ (સફેદ)

સફેદ દાણાંવાળી આ જાત ૧૨૦-૧૨૫ દિવસમા પાકી જાય છે. એકરે સરેરાશ ૧૨૫૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમોડી જેવા રોગ અને ગાભમારાની ઇથળ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે.

### (૩) ગુજરાત નવસારી નાગલી - ૬ ( ધારા કથ્યાછ દાણાંવાળી )

ભરાવદાર આકર્ષક, ધારા કથ્યાછ દાણાંવાળી આ જાત ૧૧૫-૧૨૦ દિવસમા એટલે કે મધ્યમ મોડી પાકતી જાત છે. એકરે સરેરાશ ૧૨૫૦ થી ૧૩૦૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે. કરમોડી જેવા રોગ અને ગાભમારાની હયળ સામે પ્રતિકારક જાત છે.

#### ધરુવાડિયું

ધરુવાડીયાની જમીન સહેજ ઊચાણવાળી, પિયતની સગવડતાવાળી અને નીંદણમુક્ત હોવી જોઈએ. જમીનને હળ અને કરબથી એકે ભરભર બનાવી, સમાર મારી સમતળ બનાવવી. સારું, તંકુરસ્ત અને ચિપાદર ધરુ ઉછેરવા માટે નીચેના મુદ્દાઓ એચ્યાનમાં રામવા જોઈએ.

- ૧) એક હેક્ટર રોપણી માટે ૧ મીટર પહોળા, ૫ મીટર લાંબા અને ૧૫ સે.મી. ઊચાઈના ૨૦ ગાડી ક્યારા બનાવવા.
- ૨) ક્યારા દીઠ ૧૦ કિ.ગ્રા. સારું કોહવાએલુ છાણીયું ખાતર/ વર્મિકમ્પોસ્ટ, ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ આપી જમીનમાં બરાબર લેળવી દેવું.
- ૩) વરસાદની શરૂઆત થતાં ક્યારામાં ૧૫ સે.મી.ના અંતરે કોદાળીથી છીછરા ચાસ ખોઈ બિયારણને ચાસમાં વાવેતર કરવું.
- ૪) ધરુવાડીયમાં ભેજ રહે રીતે પાણી આપવું.
- ૫) નિંદામણ જરૂરિયાત મુજબ કરતાં રહેવું.
- ૬) સામાન્ય રીતે ૨૧ થી ૨૫ દિવસના ધરુનો રોપણી માટે ઉપયોગ કરવો.

#### ફેરરોપણી

નાગલીની ફેરરોપણી માટે જુલાઇનું પ્રથમ અઠવાડિયું આદર્શ ગણાય છે. ૫ થી ૭ પાનવાળું ૨૧ થી ૨૫ દિવસના ધરુની ફેરરોપણી બે હાર વચ્ચે ૨૨.૫ થી ૩૦. સે.મી. અને બે છોડ વચ્ચે ૭ થી ૮ સે.મી.નું અંતર જગતી રોચ કાપી એક થી બે ચિપા રોપવા. ફેરરોપણી બાદ ૮-૧૦ દિવસ બાદ ખાલાં પડ્યા હોય તે પૂરવા.

#### ખાતર વ્યવસ્થાપન

એક હેક્ટર દીઠ ૬ થી ૮ ટન સારું કોહવાએલુ છાણીયું ખાતર આપવું અથવા શાણ/ ઈકકડનો લીલો પડવાશ કરવો. સેન્ટ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો. નાગલીના ધરુને ઉપાડીને રોપણી પહેલાં ૨૦૦ મી.લી./ હેક્ટર પ્રવાહી એઝેટોબેક્ટર, પીએસબી અને કેએમબી ૧૦ મી.લી. ને ૧ % ગોળના દ્રાવણમાં મિશ્ર કરી ૩૦ મિનિટ બોડી ફેરરોપણી કરવી તથા જમીન માવજત માટે ૧ લી. પ્રવાહી એઝેટોબેક્ટર ૨૦ કિ.ગ્રા./ હેક્ટર ભરભરી માટી સાથે મિશ્ર કરી નાગલીના મૂળ વિસ્તારમા આપવું.

#### પિયત વ્યવસ્થાપન

વરસાદનું પ્રમાણ સારું અને નિયમિત હોય તો પિયત આપવાની જરૂર પડતી નથી. પરંતુ, પિયતની સગવડ હોય અને પાછોતરો વરસાદ જેચાય તો એક બે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે. નાગલીના પાકમાં કોઈપણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શકતો નથી. જેથી જ્યાં પાળાવાળા જેતરમાં કે છીછરી ક્યારીમાં ધાવલ કરી ફેરરોપણી કરી હોય ત્યાં જો છૂઢું પાણી હોય તો તે નિતારી દેવું.

#### નીંદણ નિયત્રણ

નાગલીના છોડનો શરૂઆતનો વિકાસ ધીમો હોવાથી શરૂઆતના ૪૫ દિવસ સુધી પાકને નીંદણમુક્ત રાખવો. ફેરરોપણી બાદ જરૂર પ્રમાણે નિંદામણ કરવાથી રોગ-જીવાત ઓળા કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

---

## પાક સંરક્ષણ

સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. તેમ છતાં ગાભમરાની ઇયળનો કે કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્રવ જણાયતો નીચે પ્રમાણે પગલાં લેવા.

**(૧) કરમોડી (બ્લાસ્ટ) રોગ:** (૧) પ્રતિકારક જાતો વાવવી.

(૨) સ્થુડોમોનાસ એઝ્ઝનોસાનો ૬૦ મી.લી. પ્રતિ ૧૦ લી. પાણીમા ગ્રાવણ બનાવી ત્રણ છંટકાવ, પ્રથમ રોગની શરૂઆતમાં ત્યારબાદ ૧૫ દિવસના અંતરે કરવા.

**(૨) ગાભમરાની ઇયળ:** દ્રાયકોકાર્ડ પાંચ/ હેક્ટર મુજબ રોપણી બાદ ૨૫ દિવસે નાગલીના જેતરમાં ગોઠવવાં.

કાપણી અને સંગ્રહ

નાગલીનો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થઈ જાય છે. નાગલીના કણસલાં જેમ તૈયાર થાય તેમ કાપતાં જઇ ખળમાં સૂકવી દાણાં છૂટાં પાડવાં. દાણાંને સાફસૂફ કરી અનાજ ભરવાની કોઠીમાં સંગ્રહ કરવો. નાગલીના ચીપટ કાપી સંગ્રહ કરવો, જે ઢોરના ભૂકા ચારા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

## ૭. ડાંગર

(સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર, આ. કૃ. યુ., નવાગામ)

### જમીન અને જમીનની તૈયારી

ડાંગરના પાકને પાણીની વધુ જરૂરિયાત રહેતી હોવાથી વધુ નિતારવાળી જમીન માફક આવતી નથી. મધ્યમ ગોરાજુ કે કાળી જમીનમાં ડાંગરનો પાક સારો થાય છે. ડાંગરના પાકને બેજ વધુ સંગૃહી શકે તેવી કચારીની કાળી જમીન વધુ માફક આવે છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ રહે તેવી નીચાણવાળી કાંપની જમીનમાં ડાંગરનો પાક સારી રીતે લઇ શકાય છે. જમીનને સમતળ કરી ત્યારબાદ પાણી ભરીને ઘાવલ કરવું જેથી ધરુની રોપણી કરવાથી છોડને ચોટવામાં અનુકૂળતા રહેશે અને જમીનમાં નીચે જીતરી જતાં પાણીનો વ્યય અટકાવી શકાય. રોપણીના ૧૫ દિવસ પહેલાં જમીનમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણીયું ખાતર આપવું તથા ૫૦ થી ૬૦ કિ.ગ્રા. બીજ વાપરી શાણ અથવા ઈક્કડનો લીલો પડવાશ કરવો.

### જતની પસંદગી

ડાંગરના વધુ ઉત્પાદન માટે જે તે વિસ્તારની જમીન, આબોહવા અને વરસાદની પરિસ્થિતિને અનુકૂળ સુધારેલ વધુ ઉત્પાદન આપતી ઠીંગણી જાતોની પસંદગી કરવી જોઈએ. અપૂર્વતી પિયત સુવિધા કે વરસાદ આધારિત વિસ્તાર માટે વહેલી પાકતી અને પિયતની સગવડવાળા વિસ્તાર માટે મધ્યમ મોડી કે મોડી પાકતી જાતોની પસંદગી કરવી જોઈએ.

ડાંગરનો પાક એ જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડતો હોઈ જે તે જાતોની પાકવાના દિવસોના આધારે ભલામણ કરવામાં આવેલ છે.

- વહેલી પાકતી જાતો (૮૦ થી ૧૦૦ દિવસ):** એસ.કે.-૨૦, જી.આર.-૩, જી.આર.-૪, જી.આર.-૫, જી.આર.-૭, જી.આર.-૧૨, ગુજરી, આઈ.આર.-૨૮, જી.એ.આર.-૨ અને જી.એ.આર.-૩.
- મધ્યમ મોડી પાકતી જાતો (૧૦૦ થી ૧૨૦ દિવસ):** જી.આર.-૧૧, જ્યા, આઈ.આર.-૨૨, જી.આર.-૧૦૩, જી.એ.આર.-૧૩, જીએઆર.-૧ (સુગંધિત), દાંડી, એસ.એલ.આર.-૫૧૨૧૪ (ક્ષાર પ્રતિકરણ જાતો).
- મોડી પાકતી જાતો (૧૩૦ થી ૧૪૦ દિવસ):** બિન સુગંધિત: મસૂરી, સુગંધિત: જી.આર.-૧૦૧, જી.આર.-૧૦૨, નર્મદા અને જી.આર.-૧૦૪.

### બીજ દર

શુદ્ધ, ચોખ્યું, ભરાવદાર અને પ્રમાણીત બિયારણનો વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ. રોપણ ડાંગર માટે જુણાં દાણાંવાળી જાતનો ૨૦-૨૫ કિ.ગ્રા. જ્યારે જાડાં દાણાંવાળી જાતનો ૨૫-૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે બીજદરની જરૂરિયાત પડે છે. ઓરાણ ડાંગર માટે પ્રતિ હેક્ટરે ૫૦ થી ૬૦ કિ.ગ્રા. બીજદર રાખી વાવેતર કરવું.

### બીજ માવજત

- બીજને વાવતાં પહેલાં ૩% મીઠાના દ્રાવણમાં (૧૦ લિટર પાણીમાં ૩૦૦ ગ્રામ મીઠું) બોળવાથી ઉપર તરી આવતાં હલકાં, પોચા અને રોગવાળા બીજને બહાર કાઢી લેવા, જ્યારે નીચે બેઠેલાં ભરાવદાર બીજને બે-ત્રણ વાર ચોપમાં પાણીથી ધોઈને છાંચડામાં સૂકવવા.**
- વાવણી વખતે હેક્ટરે ૨ કિ.ગ્રા. મુજબ જૈવિક ખાતર એઓટોબેક્ટર કલ્યાનની ૨૫ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપવી.**

## વાવણી

ઓરાણ ડાંગર ચોમાસામાં વાવણી લાયક સારો વરસાદ થાય ત્યારે બે હાર વચ્ચે 30 સે.મી.નું અંતર રાખી વાવણી કરવી. રોપણ ડાંગર માટે ૪ થી ૫ પાનના (૨૧ થી ૨૪ દિવસના) ધરુની રોપણી કરવી.

## ધરુવાડીયું

- જેટલા વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની હોય તેના દશમાં ભાગના વિસ્તારમાં ધરુવાડીયું નાખવું, એટલે કે ૧ હેક્ટર ડાંગરની રોપણી માટે ૧૦ ગુંડા જમીનમાં ધરુવાડીયું પૂરતું છે.
- ધરુવાડીયામાં ૧ મીટર પહોળા, ૧૦ મીટર લાંબા અને ૧૫ સે.મી. ઉંચાઈના એક સરખા માપના ગાઈ કથારા બનાવવાથી એતીકાર્યો કરવામાં અનુકૂળતા રહે છે.
- કથારા દીઠ ૨૦ કિ.ગ્રા. કોહવાચેલું છાણીયું ખાતર અને ૨ કિ.ગ્રા. દિવેલીનો ખોળ જમીનમાં ધરુનાખતાં પહેલાં આપવું.
- ધરુવાડીયું મે માસના અંતમાં અને મોડામાં મોડું જૂન મહિનાના પ્રથમ પખવાડીયામાં નાખવું જોઈએ.
- કથારા દીઠ ૨૫૦ થી ૩૦૦ ગ્રામ બીજ પુંખીને અથવા ગાઈ કથારામાં ૧૦ સે.મી.ના અંતરે છીછા ચાસ ખોળી લાઇનમાં વાવેતર કરી ઢાંકી દેવું.
- બીજની વાવણી બાદ ૨૪ કલાક સુધી ગાઈ કથારામાં ૨ સે.મી. પાણી ભરી રાખવું. ત્યારબાદ ધરુવાડીયામાં સતત બેજ જળવાય રહેતે પ્રમાણે પાણી આપતાં રહેવું.
- ધરુવાડીયામાં પાણીની મેંચ પડે તો જમીનના ક્ષારો ઉપર આવે છે અને ડાંગરનું ધરુફિકું અને પીળું પડે છે તેને "કોલાટ" કહેવામાં આવે છે, જે લોહ તત્વની ઉણપને લીધે જોવા મળે છે. તેના નિયંત્રણ માટે બે થી ત્રણ વાર ધરુવાડીયામાં પાણી ભરી નિતારી અને પછી પાણી ભરી રાખવું.
- સામાન્ય રીતે ૨૨ થી ૨૪ દિવસે ધરુ ૪ થી ૫ પાનનું થાય ત્યારે રોપણીલાયક બને છે. મોટી ઉંમરના ધરુની રોપણી કરવાથી કૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

## ફેરરોપણી

ડાંગરની ફેરરોપણી માટે જુલાઇનું પ્રથમ પખવાડીયું આદર્શ સમય છે. ડાંગરની ફેરરોપણી બે હાર વચ્ચે ૨૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી.નું અંતર રાખી થાણા દીઠ ૨-૩ ધરુ રોપવા. રોપણી માટે ૪ થી ૫ પાનવાળું ૨૪ દિવસનું ચીપાદાર ધરુ ઉત્તમ ગણાય છે. ધરુની રોપણી વખતે પાનનો ટોચનો ભાગ કાપી રોપણી કરવી.

સમયસર ધરુ ઉછેર થઈ શકેલ ન હોય અથવા રોપણી સમયે મજુરોની અછત રહેતી હોય, જેથી સમયસર ડાંગરની રોપણી થઈ શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં ડાંગરના ફણગાવેલ બીજથી વાવેતર કરવાથી ડાંગરનો પાક સારો લઈ શકાય છે.

## ખાતર વ્યવસ્થાપન

- ડાંગરમાં હેક્ટરે ૧૦ ટન મુજબ છાણીયું ખાતર આપવું.
- છાણીયા ખાતરના બદલે દિવેલીનો ખોળ ૨ ટન અથવા વર્મિકમ્પોસ્ટ ૨ ટન આપી શકાય.
- હેક્ટરે ૫૦ થી ૬૦ કિ.ગ્રા. બીજ વાપરી શાણ અથવા ઈક્કડનો લીલો પડવાશ કરવો.
- રોપણી કરતાં પહેલાં ધરુના મૂળને જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટર/ એઓસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર ૧૦ મી.લી. પ્રતિ લીટર પાણીમાં ૩૦ મીનિટ બોળીને માવજત આપી રોપણી કરવી.
- કથારીમાં હેક્ટરે ૬ થી ૭ ટન અઝોલા અથવા ૧૦ કિ.ગ્રા. બલ્યુગ્રીન આલ્ફી આપી શકાય.
- રોપણીના ૩૦ થી ૪૦ દિવસ પછી જૈવિક ખાતર જેવા કે એઝોટોબેકટર અથવા એઓસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર (૧ મી.લી. ૧૦૮ જીવન્તકોષ) ૨.૫ લીટર પ્રતિ હેક્ટર પ્રમાણે ૩૦૦ કિ.ગ્રા. આણીયા ખાતર સાથે મીશ્ર કરી આપવું.

- સી-વીડ (ગ્રાસીલેરીયા સ્પીસીસ) ૨.૫% રોપણી બાદ ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

### **પિયત વ્યવસ્થાપન**

- ડાંગરમાં પિયત અંગે નીચેના મુદ્દાઓ દ્યાનમાં રાખવા જરૂરી છે.
- શરૂઆતના જીવનકાળ દરમ્યાન રોપણીથી ફૂટ નીકળે (૩૫ દિવસ સુધી) ત્યાં સુધી પાણીની ખાસ જરૂર હોય છે ત્યારે ૨ થી ૩ સે.મી. પાણી ભરી રાખવું.
  - કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂટ અવસ્થા, જીવ પડવો અને દાણાં ભરાવવાની અવસ્થા હોય ત્યારે ૪ થી ૫ સે.મી. જેટલું પાણી કાંઈમાં ભરી રાખવું.
  - જીવ પડવાની શરૂઆત થાય તે પહેલાં એટલે કે વહેલી પાકતી તથા મધ્યમ મોડી પાકતી જાતો માટે ૩૦ થી ૩૫ દિવસ વચ્ચે એકવાર પાણી કાઢી નિતાર આપવો, જ્યારે મોડી પાકતી જાતો માટે ૩૫ થી ૪૦ દિવસ વચ્ચે અને ૫૦ થી ૫૫ દિવસ વચ્ચે એમ બે વાર પાંચ-પાંચ દિવસનો નિતાર આપવાથી ઉત્પાદન વધારે મળે છે.
  - કંટી નિકળ્યા બાદ ૨ અઠવાડિયા સુધી પાણીની વધુ જરૂર રહે છે એટલે આ અવસ્થા દરમ્યાન ૫ થી ૭.૫ સે.મી. પાણી લરેલ રાખવું.
  - પરિપક્વ અવસ્થાએ દાણાંનો રંગ પીળો થવા માંડે છે તે સમયે એટલે કાપણીના ૧૫ થી ૨૦ પહેલાં કાર્યાલાંથી પાણી કાઢી નાંખવાથી પાક એક સાથે પાકી જાય છે અને કાપણી સરળ બને છે.

### **નીદણ વ્યવસ્થાપન**

ડાંગરના પાકને રોપણી બાદ ૧૫ થી ૪૫ દિવસ સુધી નીદણમુક્ત રાખવો જોઈએ. ફેરરોપણી બાદ ૧૫ દિવસે આંતરખેડ કરવી અને ૨-૩ નિંદામણ કરવા. કાર્યાલાં પાણીનું થોળ્ય પ્રમાણ જાળવવાથી પણ નીદણનો ઉપક્રમ ઓછો જોવા મળે છે.

### **રોગ અને જીવાત નિયંત્રણ**

ડાંગરના પાકમાં મુખ્યત્વે કરમોડી, પાનનો સુકારો, ગલત આંજુયો, પાનના ટપકાનો રોગ, થડનો સડો, લાલ બદામી દાણાં અને પોષક તત્વોની ઉણાપથી થતા રોગ જોવા મળે છે.

- (૧) **જીવાણી થતો મજારો:** આ રોગમાં પાનની ટોચેથી ધારો સૂક્ષ્માઈ ધીમે ધીમે છોડ અને કંટી પણ સૂક્ષ્માય છે. ડોડા અવસ્થાએ વધુ પડતાં નાઈદ્રોજનયુક્ત ખાતરો આપવાથી આ રોગ તીવ્ર રૂપમાં આવે છે.
- (૨) **ગલત અગ્રારિયો:** કંટી નીકળે ત્યારે દાણાંની જગ્યાએ પીળા ચણા જેવી ગાંધી થાય છે. પાછળથી કાળા પાઉડરના રૂપમાં ફેરવાય છે.

ડાંગરના પાકમાં જીવાતોમાં ખાસ કરીને પાન વાળનાર ઈથળ, ગાભમારાની ઈથળ અને ચૂસિયાંનો ઉપક્રમ જોવા મળે છે.

- (૧) **ગાભમારાની ઈથળ:** રોપણી પછી ૨૫-૩૦ દિવસે છોડનો વચ્ચેનો પીલો સૂક્ષ્માય છે જેને કેડહાર્ટ કહે છે. કંટી વખતે કંટી સૂક્ષ્માઈ ને સફેદ થર્ડ દાણાં ભરાતાં નથી અને ખેંચતાં સહેલાઈથી ખેંચાઈ આવે છે. જેને સફેદ પીંછી (વ્હાઈટ ઈથર હેડ) કહે છે.

- (૨) **સફેદ પીકવાળાં ચૂસિયા:** છોડના થડમાંથી રસ ચૂસી નબળો પાડી સૂકવી નાંખે છે.

- (૩) **લાલી ઈથળ:** ઈથળ રાત્રી દરમ્યાન પાન, થડ અને કંટી કાપી ખાય છે. દિવસે સંતાઈ રહે છે.

### **રોગ અને જીવાત નિયંત્રણ માટેના પગલાં**

- રોગમુક્ત વિસ્તારનું તંકુરસ્ત બિયારણ પસંદ કરવું.
- રોગપ્રતિકારક જાતોની પસંદગી કરવી.

- એતરના શેઢાપાળા નીંદણમુક્ત અને સાફ રામવા.
- ઉનાળામાં ઉંડી ખેડ કરીને જમીનને તપાવવી અને પાકની ફેરબદલી કરતાં રહેવાથી થડનો જડો રોગ અટકે છે.
- જૈવિક ખાતર સુડોમોનાસ સ્પીસીસનો ૧૦ મી.લી. પ્રતિ લીટર પાણીનો છંટકાવ કરવાથી ડાંગરના ફૂગજન્ય તેમજ જીવાણુંજન્ય રોગોનું નિયંત્રણ થાય છે.
- શક્ય હોય ત્યાં ડાંગરની ફેરરોપણી વહેલી (જુલાઈના પ્રથમ અકવાડિયામાં) કરવાથી ચૂસિયાથી થતું નુકશાન ઘટાડી શકાય છે.
- ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે દ્રાઇકોગ્રામાના પાંચ કાર્ડ પ્રતિ હેક્ટર (એક લાખ ભમરી પ્રતિ કાર્ડ) રોપણીના ૨૦ થી ૨૫ દિવસ બાદ ૧૫ દિવસના અંતરે ત્રણ વાર લગાવવાં.
- ડાંગરની ફેરરોપણી વખતે ઘરુના પાનની ટોચો કાપી નાંખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મુકેલ ઠંડાના સમૃહનો નાશ થશે, આમ થતાં તેનો ઉપદ્રવ ઘરુવાડીયામાંથી રોપણ કરેલ એતરમાં આગળ વધતો અટકી શકે છે.
- ચૂસિયાનો ઉપદ્રવ જોવા મળે એટલે પાણીનો નિતાર કરવો.
- ડાંગરના છોડને પહોળા ગાળે રોપવાથી પણ રોગનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
- ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે રોપણી બાદ પાન પર મૂકાયેલા ઈંડાના સમૃહો વીણીને નાશ કરવા, એતરમાં રાત્રિના સમયે પ્રકાશપિંજર ગોઠવી ફૂદાંઓને આકષિને નાશ કરવા. હેક્ટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તથા તેમાં ૧૫ થી ૨૧ દિવસે લ્યુર બદલવાથી ઉપદ્રવની જાણકારી મેળવી શકાય છે.
- ડાંગરની ઈયળ ડોશીના ઉપદ્રવ વખતે એતરમાંથી દોરડું પસાર કરવાથી ઈયળો ભૂગળી સાથે પાણીમાં પડી જાય છે તેનો જ્યારી નિતારી એતરના છેડે એકઠી કરીને તેનો નાશ કરવો.
- કાપણી બાદ એતરમાં રહેલ જડિયાં દૂર કરવાથી જડિયાંમાં સૂષુપ્ત અવસ્થામાં રહેલી લશકરી ઈયળ તેમજ ગાભમારાની ઈયળનો નાશ કરી શકાય છે. પાણીની વ્યવસ્થા હોય ત્યાં કાપણી બાદ પાણી ભરી રાખવાથી કોશેટાનો નાશ થાય છે.
- કાપણી બાદ પાકના રોગિઝ અવશેષો બાળીને નાશ કરવો. શક્ય હોય તો શેઢાપાળાના ધાસ ઉપર સુંપ પરાળ પાથરીને સળગાવવાથી ફૂગનો નાશ થાય છે.
- રોગિઝ છોડનો બાળીને નાશ કરવો.
- લશકરી ઈયળ માટે રાત્રે ધાસની હગલીઓ કરી સવારે ઈયળો સહિત વીણી લઈ નાશ કરવો. તેમજ ઘરુવાડીયા અને એતરની ફરતે એકાદ ફૂટ ઊંડી ખાઈ ખોડવાથી ઈયળ તેમાં પ્રવેશી શકતી નથી.
- લીંબોળીના અક્ષણું દ્રાવણ ૫ % (૫૦ મિ.લી./ ૧૦ લીટર પાણીમાં) પ્રમાણે છંટકાવ કરવાથી ડાંગરના ભૂરા, સફેદ અને લીલા તતીયાનું નિયંત્રણ થાય છે.
- બીવેરીયા બાસીયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવાથી ચૂસિયાનું નિયંત્રણ થાય છે.

### ડાંગરની ચાર સુત્રી (સીરા) પદ્ધતિ

સીરા પદ્ધતિ સરળ, કાર્યક્ષમ, નફાકારક અને પર્યાવરણ મિત્ર છે. સીરા પદ્ધતિનાં મુખ્ય ચાર મુદ્દાઓ છે.

- (૧) ડાંગરના અવશેષોનો ફેર વપરાશ
- (૨) જોરીસીડિયાના પાનનો લીલો પડવાશ તરીકે ઉપયોગ
- (૩) ચોક્કસ અંતરે જોડીયાહાર પદ્ધતિથી ફેરરોપણી
- (૪) છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ સાથે દિવેલીનો ખોળ કે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો.

---

## ડાંગરમા “શ્રી” (એસઆરઆઇ) પેતી પદ્ધતિ

સીસ્ટમ ઓફ રાઇસ ઇન્નેસીફીકેશન ‘શ્રી’ ના દ્રોકા નામથી પ્રચલિત છે. શ્રી પદ્ધતિમાં કેટલીક તાંત્રિકતાઓનો સમન્વય છે, જેમાં ડાંગરના ધરુ, જમીન, પાણી તે મજ પોષણને અનુલક્ષીને, ધરુ ઉછેર, રોપણી સમય, પાણી, ખાતર અને નીદણ નિયંત્રણમાં થીડો ફેરફાર કરવામાં આવેલ છે.

### “શ્રી” પદ્ધતિના મહત્વના છ મુદ્દાઓ:

- (૧) ઓછી ઉમરના ધરુને માટી સાથે ઉપાડીને રોપણી કરવી (૮ થી ૧૨ દિવસનું ધરુ).
- (૨) એક જ ધરુની રોપણી કરવી.
- (૩) પહોળા અંતરે ( $25 \times 25$  સે.મી.) રોપણી કરવી.
- (૪) જમીનમાં ફક્ત બેજ જાળવવો (પાણી ભરી રાખવું નહીં).
- (૫) કોનો વીડરનો ઉપયોગ કરી બે હાર વચ્ચેનું નીદણને નાશ કરવો.
- (૬) સેન્ટ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો.

### પાકની કાપણી

ડાંગરમાં કાપણીનો સમય ખાસ સાચવવો પડે છે. ડાંગરના ઉપરના પાન પૂરા સૂક્ષ્માચા ન હોય પરંતુ કંઈમાં દાણાં કઠણ થવા માંડે અને તેનો રંગ પીળો પડે ત્યારે પરિપક્વ અવસ્થાએ કાપણી કરવી. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણાં ખરી પડવાનો અને ચોખામાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે ડાંગરના પાકમાં કંઈ નિકલ્યા બાદ ૨૫ થી ૩૦ દિવસે ડાંગરનો પાક કાપવા લાયક બને છે. જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનું પ્રમાણ વધુ મળે છે.